

All Women PSK

March 08, 2021

સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત પાસપોર્ટ સેવા કેન્દ્ર

માર્ચ 08, 2021

રાજ્યકક્ષાના વિદેશ મંત્રી શ્રી વી. મુરલીધરને 8 માર્ચ 2021ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મંત્રાલયના પાસપોર્ટ સેવા કાર્યક્રમ હેઠળ બે પાસપોર્ટ સેવા કેન્દ્રોને 'સંપૂર્ણપણે મહિલા સંચાલિત પીએસકે'માં રૂપાંતરિત કર્યા હતા. તેમાંથી એક નવી દિલ્હીમાં આર કે પુરમ, ભીખાજી કામા પ્લેસ ખાતે અને બીજું કેરળમાં કોચિન ખાતે ત્રિપુનીથુરામાં આવેલું છે.

પાસપોર્ટ સેવા કેન્દ્ર એ ભારત સરકારનો એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે અને તે સૌથી સફળ કાર્યક્રમો પૈકી એક તરીકે ઉભરી આવ્યો છે જેમાં ભારતમાં વસતા તથા દેશ બહાર વસતા ભારતીય નાગરિકોને પાસપોર્ટને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમે ડિજિટલ ઈન્ડિયાની પરિકલ્પનાને અસરકારક રીતે સાકાર કરી છે, જેમાં નીચે મુજબની સિદ્ધિ મળી છે:

i. નાગરિકોને સર્વવ્યાપક રીતે તેમના ઘરઆંગણે પાસપોર્ટને લગતી સેવાઓ પહોંચાડવા માટે તમામ હિતધારકો માટે ડિજિટલ ઈકોસિસ્ટમ.

ii. સરળ ગવર્નન્સ અને સેવાઓમાં આસાની

iii. નાગરિકોનું ડિજિટલી સશક્તિકરણ

મે 2014થી મંત્રાલયે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ભારત બહાર પણ નાગરિકોને પાસપોર્ટ સેવા પૂરી પાડવામાં ગુણાત્મક અને જથ્થાત્મક સુધારા લાવવા વિવિધ પગલાં લીધા છે. પરિણામે દેશભરમાં હાલની 36 પાસપોર્ટ ઓફિસ ઉપરાંત 93 પાસપોર્ટ સેવા કેન્દ્રો અને 426 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ કાર્યક્રમ વિદેશમાં 190 ભારતીય મિશન/પોસ્ટ સુધી વિસ્તારવામાં આવ્યો છે જેથી એક વૈશ્વિક હાજરી રચાઈ છે. મંત્રાલયે લીધેલા પગલાંના કારણે નાગરિકોને સમયસર, પારદર્શક, વધુ સરળ અને વિશ્વસનીય રીતે પાસપોર્ટ સેવા પહોંચાડવામાં મદદ મળી છે. જેમાં તેઓ સુરેખ પ્રક્રિયા, પ્રતિબદ્ધ, તાલીમબદ્ધ અને પ્રેરિત શ્રમબળ દ્વારા આરામથી સેવા મેળવી શકે છે. પાસપોર્ટની પ્રક્રિયા, મેન્યુઅલ અને નિયમોને સરળ બનાવવા માટે પણ પગલાં લેવાયા છે.

ઉપર જણાવ્યા ઉપરાંત મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમ હેઠળ મહિલાઓના સશક્તિકરણ માટે પગલાં લીધા છે. પાસપોર્ટ સેવા કાર્યક્રમ હેઠળ કુલ 1670 મહિલા કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવી છે. પાસપોર્ટ સેવા કાર્યક્રમ દ્વારા અત્યાર સુધીમાં 2.76 કરોડથી વધુ અરજકર્તાઓને પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં

1.03 કરોડ પાસપોર્ટ મહિલા અરજકર્તાઓને ઈશ્યૂ કરાયા છે જે કુલ અરજકર્તાઓના 35% થાય છે.

મંત્રી શ્રી મુરલીધરને જણાવ્યું કે જીવનના વિવિધ ક્ષેત્રોમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે સંતુલન સ્થાપવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે, પછી તે વ્યાવસાયિક હોય કે વ્યક્તિગત. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ પ્રગતિશીલ, ટેકનોલોજીની દૃષ્ટિએ આધુનિક અને સામાજિક વૈવિધ્યપૂર્ણ સમુદાય બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. 8 માર્ચ 2021ના રોજ ઉપસ્થિત રહેલા પ્રતિષ્ઠિત સમૂહ પરથી મહિલાઓની સિદ્ધિઓ સ્પષ્ટ જોઈ શકાતી હતી જેમાં ભારતીય વાયુસેના, રેલવે, આરોગ્ય ક્ષેત્ર, મીડિયા અને મનોરંજન ક્ષેત્રના મહિલા આગેવાનો હાજર હતા. પાસપોર્ટ કેટલી સરળતાથી મેળવી શકાય છે તે વિશે જાગૃતિ પેદા કરવા માટે આ પદાધિકારીઓને ફેન્ડ્સ ઓફ પાસપોર્ટ સેવા પ્રોગ્રામ નામ આપવામાં આવ્યું છે.

નવી દિલ્હી

માર્ચ 08, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.